

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૮/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૨૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૨ કેસ કરી, ૧૨ વ્યક્તિઓને ઝડપી ૧૧૩ લીટર દેશી દારૂ, ૩૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ અને ૬ બીયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૨ કેસ કરી, ૪ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૧૬,૨૨૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૨૫/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૨ વ્યક્તિઓની તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૭૨૬/૧૬

નરોડા: રોહિતભાઈ હરેશભાઈ થાવાણી (રહે, મનમંદિર બંગ્લોઝ, બંગ્લા એરીયા, કુબેરનગર, સરદારનગર) એ તા.૧૮/૮/૧૬ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૭/૧૬ થી આજદીન સુધીનાં સમયગાળા દરમિયાન સુતરના કારખાના ચાર રસ્તા નજીક શ્રીજી એસ્ટેટ ખાતે આવેલ રોહિતભાઈની જયભવાની મોટર્સની ઓફીસ ખાતે તથા આરોપીની ગેલેક્ષી ખાતેની ઓફીસ અને નરોડા નાગરિક કો.ઓ.બેન્ક ખાતેથી આરોપી નીખીલ જયેન્દ્રભાઈ વ્યાસ (રહે, મણીલાલ પાર્ક સોસાયટી, કઠવાડા રોડ, નરોડા) એ પોતાની ઇનોવા કાર વેચવાની છે તેમ કહી, રોહિતભાઈને કાર બતાવી, કારની કિંમત રૂપિયા ૧૦,૨૦,૦૦૦/- નક્કી કરી, તે પેટે રૂપિયા ૨૦,૦૦૦/- બાના પેટે મેળવી લઈ, કારના લોનના રૂપિયા ૬,૩૨,૦૦૦/- નાગરિક કો.ઓ.બેંકમાં નીખીલે તેના ખાતામાં ભરાવી, ઉપાડી લીધા હતા. ત્યારબાદ કાર નહીં આપતા રૂપિયાની માંગણી કરતા રોહિતભાઈને રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એચ.જાડેજા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.